

**DEEP  
Industries  
Limited**

**Oil & Gas Field Services**

February 07, 2024

To,  
**Corporate Relations Department**  
**BSE Limited**  
2<sup>nd</sup> Floor, P.J. Towers,  
Dalal Street,  
Mumbai – 400 001

To,  
**Corporate Relations Department**  
**National Stock Exchange of India Limited.**  
Exchange Plaza, Plot No. C-1, Block-G,  
Bandra Kurla Complex, Bandra (East),  
Mumbai – 400 051.

**SCRIP CODE : 543288**

**SYMBOL : DEEPIND**

**Sub.: Newspaper Publication of Financial Results – Regulation 47 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.**

Dear Sir/Madam,

In compliance with Regulation 47 and other applicable provisions of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith the copy of newspapers advertisement published on Wednesday, February 07, 2024 in Business Standard (English) and Jai Hind (Gujarati) editions wherein the Unaudited standalone and consolidated Financial Results of the Company for the quarter and nine months ended on December 31, 2023 as approved by the Board of Directors of the Company at its meeting held on Tuesday, February 06, 2024 have been published.


This intimation will also be uploaded on the Company's website at [www.deepindustries.com](http://www.deepindustries.com).

You are requested to take the same on your record.

Thanking You,

Yours faithfully,

**For, Deep Industries Limited**

  
Shilpa Sharma  
Company Secretary & Compliance Officer  
M.No : A34516



Encl.: a/a



**DEEP INDUSTRIES LIMITED (Formerly Known as Deep CH4 Limited)**  
Regd.Off.: 12A & 14 Abhishree Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad-380058  
Tel: +91 2717 298510 M: +91 98256 00533 Fax: +91 2717 298520  
Email: info@deepindustries.com Website: www.deepindustries.com





NOTICE OF LOSS OF SHARES OF HINDUSTAN UNILEVER LIMITED (Formerly Hindustan Lever Limited (HUL))				
Regd. Office: Hindustan Unilever Limited, Unilever House, B.D. Savant Marg, Chakla, Andheri (East), Mumbai - 400099.				
NOTICE is hereby given that following share certificates have been reported as lost, and the Company intends to issue duplicate certificates in lieu thereof. In such case, any person who has a valid claim of the said share should lodge such claim with the Company at its registered office within 15 days hereof:				
Folio No.	Certificate No.(S)	No. of Share (Rs.1/- F.V.)	Distinctive No.(S)	Name of Share Holder
2934781	5291025	300	1148528151 to 148528450	Gowindhai Ravishai Patel
Date: 07.02.2024	Place: Ahmedabad	For, Hindustan Unilever Limited Dev Bajpai Company Secretary		

**NOTICE**

NOTICE is hereby given that the Certificate(s) for Equity 111 Shares face value Rs. 10/- Dist. Nos.: 000528013-000528041/0085285C3-008528584, Folio No.: C00872 Certificate No.: 00007730 of **ABBOTT INDIA LTD.** Standing in the name(s) of Jyotiaben Arjunsinhji Chauhan has lost or mislaid and the undersigned have applied to the Company to issue duplicate Certificate(s) for the said shares. Any person who has a claim in respect of the said shares should lodge such claim with the Company at its Registered Office, **ABBOTT INDIA LTD., 3-4 CORPORATE PARK, SION-TROMBAY ROAD, MUMBAI - 400 071**, within one month from this date else the company will proceed to issue duplicate Certificate(s).

Name(s) of Shareholder(s)  
Date 07/02/2024  
Jyotiaben Arjunsinhji Chauhan

**UTTARAKHAND ELECTRICITY REGULATORY COMMISSION**  
'Vidyut Niyamak Bhawan', Near ISBT, P.O.Majra, Dehradun-248171,  
Ph. 0135-2641115, Website www.uerc.gov.in, E-mail-secy.uerc@gov.in**CONSULTANT REQUIRED**  
**TIME EXTENSION NOTICE**

Uttarakhand Electricity Regulatory Commission (UERC) had issued ToR to appoint Consultant for assisting in 'Scrutiny of Capital Cost and Determination of Annual Fixed Charges (AFC)' for Tariff of Vysa HEP (2x60 MW) of UJVNL Ltd. for the Fourth Control Period from FY 2022-23 to FY 2024-25 under UERC (Terms and Conditions for Determination of Multi Year Tariff) Regulations, 2021 and invited bids by 22.01.2023 and further extended to 08.02.2024. However, due to insufficient participation of bidders, the Commission decided again extend the time for submission of afresub bid by 26.02.2024 upto 15:00 hrs.

A set of bid documents and terms and conditions of the bid may be obtained in person by any interested eligible consultancy firms from the Commission's office from 07.02.2024 from 10:00 hrs to 17:00 hrs on all working day till 25.02.2024 or may also be downloaded from the Commission's website: [www.uerc.gov.in](http://www.uerc.gov.in).

Interested parties may submit their Technical and Financial proposals by 26.02.2024 upto 15:00 hrs and Technical bid shall be opened on 26.02.2024 at 16:00 hrs. The bidders who have already submitted their bid need not to apply again. The Commission reserves the right to accept or reject any or all the tenders/quotations without assigning any reasons.

Advt. No. 21/2023-24  
Secretary

**Public Notice**

This is to inform that to the General Public at large that My Client Mr.Rahul Kumar Surendhbhai Patel is Owner of the Property "All that piece or parcel, right, interest, title of land along with structure standing there on and to be constructed there on being The immovable Non Agriculture Commercial Property out of Survey Number No.681-682 Palki, Vacant Plot No.31, total area measuring 139.35 Sq Meter, 150C-00251/1/1 situated in the situated in the limits of Palanpur, Tal- Palanpur, Dist- Baraswantha State- Gujarat. That my Client has purchased the said property from (1)Mr.Manushal Ambala Patel (2). Mr.Dineshbhai Amarpanday Patel and (3) Mr.Rajendra Navanida Patel by registered sale deed No.5726 dated 17/04/2023. Before that (1) Mr.Mitulbhai Ambala Patel (2) Mr.Dineshbhai Amarpanday Patel and (3) Mr.Rajendra Navanida Patel by registered sale deed serial No.4572 dated 03/12/2009. Before that (1) Mr.Kunjilal Parshotambhai Patel by registered sale deed serial No.10361 Dated 29/10/2016 Registered in the name of Shri Chirag Prabhubhai Patel and Smt. Jagruti Chirag Patel at Sub Registrar Office, Ankleshwar.

Further you inform that my Client is mortgaging the said property in favour of Indian Overseas Bank as a security against the financial facilities availed to be availed by him.

Any person who has/had and the said Original Sale Deed and/or any person having any right, title, claim, share of inter/ty to the said property by way sale, exchange, mortgage, let, remains, easement, trust, possessory or otherwise of what so ever nature hereby required to make the same in writing along with the documentary evidence to the undersigned at the address mentioned below within 7 days from the start of publication failing which it shall be deemed to have been waived and given up and our client shall proceed further without reference to such claims, if any received afterwards.

This notice issued by me and herewith mention Addres for invit

eections:-

Place:- Palanpur

Ramesh K.Tharwani  
Advocate & Notary

Date:-06/02/2024

16,Timurti Complex, 2<sup>nd</sup> Floor, No.SBI Bank,

Ahri High Way, Palanpur, Pin-385001.

Tel:- Palanpur, Dist:- B.K. Mobile No.: 9925099400

**SBI STATE BANK OF INDIA - RASECC (10069) BHARUCH**  
4th Floor, Golden Square, Bholav Road, Bharuch - 392001  
Phone: (02642) 225052, 227152, Email: sbi.10069@sbi.co.in**PUBLIC NOTICE**

Housing Loan Account Number : 36215180732.

Loan Holder : Mr. Chirag Prabhubhai Mistry & Mrs. Jagruti Chirag Mistry:  
Regarding document misplaced (missing).

Therefore, in the above context, it has come to our knowledge that the original documents mentioned below have been misplaced (missing) from our records during the period from March-2023 to May-2023.

1) Immovable property: Original Sale Document (Deed of Assignment) of Flat No. 3-401, 4th Floor, Candle Wood Co-operative Housing Society, Revenue Survey No. 556, GIDC Plot No. H 3089, Moja-Kosarodi, Taleka-Ankeshwar, District-Bharuch ) no.10362 Dated: 25/10/2016 Registered in the name of Shri Chirag Prabhubhai Mistry and Mrs. Jagruti Chirag Mistry at Sub Registrar Office, Ankleshwar.

2) Immovable Property: Original Sale Document (Deed of Assignment) of Flat No. 3-402, 4th Floor, Candle Wood Cooperative Housing Society, Revenue Survey No. 556, GIDC Plot No. H 3089, Moja-Kosarodi, Taleka-Ankeshwar, District-Bharuch ) no.10362 Dated: 25/10/2016 Registered in the name of Shri Chirag Prabhubhai Mistry and Mrs. Jagruti Chirag Mistry at Sub Registrar Office, Ankleshwar.

3) Original Mortgage Deed No. 10396, Dated: 29/10/2016 in favor of State Bank of India RASECC Bharuch on the immovable properties of Rank 1 and Rank 2) mentioned above at Sub Registrar Office, Ankleshwar.

The above three original documents have not been found till date despite intensive search. Our search operation is ongoing.

It is hereby advised that any person who has received /should contact State Bank of India RASECC Bharuch. We have also reported the matter to the local police.

Date: 07.02.2024

Authorised Officer

Place : Bharuch

State Bank of India (RASECC) Bharuch

**DEEP INDUSTRIES LIMITED**

Reg. Office : 12 A & 14, Abhisree Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad - 380058. Ph : 02717-298510 Fax : 02717-298520  
Email : cs@deepindustries.com [www.deepindustries.com](http://www.deepindustries.com)  
CIN:L14292GJ2006PLC049371

**EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED ON DECEMBER 31, 2023 (₹ In Lakhs)**

Sr. No.	Particulars (Refer Notes below)	Quarter Ended 31.12.2023	Nine Months Ended 31.12.2023	Quarter Ended 31.12.2022
		Unaudited	Unaudited	Unaudited
1	Total Income from Operations ('net)	11,383.05	33,173.77	10,011.73
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	3,724.74	11,312.55	3,267.15
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	3,724.74	11,414.05	3,267.15
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	2,794.36	8,848.33	2,493.30
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	2,773.09	9,002.17	2,493.30
6	Equity Share Capital (Face Value of ₹. 5/- Per Share)	3,200.00	3,200.00	3,200.00
7	Other Equity			
8	Earning per share of ₹. 5/- each (from Continuing Operations)	4.37	13.83	3.90
	Basic (in ₹.)			
	Diluted (in ₹.)	4.37	13.83	3.90

Notes: 1. The above consolidated financial results of Deep Industries Limited, its subsidiary have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on 08th February, 2024. The statutory auditor have carried out Limited Review of above consolidated & below standalone financial results of the Company.

**Key Standalone Financial Information is given below:**

1	Total Income from Operations ('net)	10,201.00	29,232.66	9,464.38
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	3,236.48	9,596.52	3,003.71
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	3,236.48	9,596.52	3,003.71
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	2,425.69	7,185.04	2,229.86
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	3,200.00	3,200.00	3,200.00
6	Equity Share Capital (Face Value of ₹. 5/- Per Share)			
7	Other Equity			
8	Earning per share of ₹. 5/- each (from Continuing Operations)	3.79	11.23	3.48
	Basic (in ₹.)			
	Diluted (in ₹.)	3.79	11.23	3.48

1. The above is an extract of the detailed format of quarter and nine months ended financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full format of the financial results are available on the Stock Exchange website ([www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com)) and on the Company's website (<http://www.deepindustries.com>).

2. Figures of previous reporting periods have been regrouped/reclassified wherever necessary to correspond with the figures of the current reporting period.

On behalf of Board of Directors

Sd/-

Paras Shantilal Savla

Chairman & Managing Director, DIN: 00145639

Place : Ahmedabad  
Date : 08.02.2024

Branch Office: ICICI Bank Towers, Near Chakli Circle, Old Padra Road, Vadodara- 390007.

**PUBLIC NOTICE - TENDER CUM E-AUCTION FOR SALE OF SECURED ASSET**

[See proviso to rule 01(6)]

**Notice for sale of Immoveable assets**

F-Auction Sale Notice for Sale of Immoveable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described Immoveable property mortgaged/charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of ICICI Bank Limited will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis/with all known and unknown dues on 27/02/2024.

The Authorised Officer of Pegasus has taken physical possession of the below described secured asset being Immoveable property on 05/11/2023 under the provisions of the SARFAESI Act, and Rules thereunder.

The details of the E-auction are as follows:

Sl. No.	Name of Borrower(s)/ Co-Borrowers/ Guarantors/ Loan Account No.	Details of the Secured asset(s) with known encumbrances, if any	Amount Outstanding	Reserve Price	Date and Time of Property Inspection	Date & Time of E-Auction
(A)	(B)	(C)	(D)	(E)	(F)	(G)





</